

30 ઓગસ્ટ 2018

## બ્રમ્પટન નગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારો માટે 2018નું માહિતી અધિવેશન

બ્રમ્પટન, ઓન્ટારિયો – ગુરુવાર, સપ્ટેમ્બર 13, 2018ના રોજ 2018ના નગરપાલિકાની ચૂંટણીના પ્રમાણિત ઉમેદવારો માટે સીટી ઓફ બ્રમ્પટન એક માહિતી અધિવેશનનું આયોજન કરશે. માહિતી અધિવેશન સાંજે 7 થી સાંજે 9 સુધી ગાર્ડન્સ રિક્રિએશન સેન્ટર, 340 વોડન સ્ટ્રીટ ઈસ્ટ, બ્રમ્પટન ખાતે ડાથ ધરાશે.

અધિવેશનમાં ચૂંટણી સંબંધિત વિવિધ વિષયો ડાથ પર લેવાશે જેમાં મતદાતાની લાયકાત, એડવાન્સ વોટિંગ, ઉમેદવાર અને મતપત્ર તપાસનારના આચરણ, નાણાકીય અહેવાલ આપવા વિશે અને ચૂંટણી નિશાનના નિયમોનો સમાવેશ થશે. સ્થળ પર ઇલેક્ટ્રોનિક વોટ ટેબ્યુલેટર અને સુલભ વોટિંગ યુનિટ જોવા માટે રાખવામાં આવશે.

પોતાની ડાજરીનું સમર્થન કરવા માટે ઉમેદવારોને [bramptonvotes@brampton.ca](mailto:bramptonvotes@brampton.ca) પર ઈમેલ કરી નોંધણી કરવા જણાવવામાં આવે છે. જો ઉમેદવાર ડાજર રહી શકે તેમ ન હોય તો તેઓ વતી ડાજર રહેવા તેમના દ્વારા નિયુક્ત કરેલ વ્યક્તિની નોંધણી થઈ શકશે. નોંધણી સપ્ટેમ્બર 10 સુધીમાં પ્રાપ્ત થવી જોઈશે.

"નગરપાલિકાની ચૂંટણીમાં બે મહિના કરતાં પણ ઓછો સમય બાકી રહ્યો છે ત્યારે, અમે ઉમેદવારોને ચૂંટણી પ્રક્રિયા વિશે વધુ જાણવાની તક પૂરી પાડી રહ્યાં છીએ, અને અમે વિશિષ્ટપણે બ્રમ્પટન વિષયક અગત્યની માહિતી આપીશું" એવું બ્રમ્પટન નગરપાલિકા ચૂંટણીના સીટી ક્લર્ક અને નિર્વાચન અધિકારી, પીટર કે એ જણાવ્યું હતું.

ઉમેદવાર માહિતી અધિવેશન સંબંધિત પ્રશ્નો માટે, શોના ડેન્ટન, ચૂંટણી સંકલનકર્તાનો સંપર્ક 905.874.3952 પર કરશો. 2018 બ્રમ્પટન નગરપાલિકાની ચૂંટણી અંગેની વધુ માહિતી મેળવવા માટે અહીં મુલાકાત લો [www.brampton.ca/bramptonvotes](http://www.brampton.ca/bramptonvotes).

-30-

**બ્રમ્પટન વિશાળ આયોજનો વિષે વિચારો છે.** અમે તીક્ષ્ણ ફેકસ ધરાવતું ભવિષ્ય માટે તૈયાર સંગઠન છીએ. અમે જાણીએ છીએ કે આપણા સમુદાયની વૃદ્ધિ, યુવાની અને વૈવિધ્ય આપણને અલગ ઓળખ પ્રદાન કરે છે. અમે કનેડાના ઈનોવેશન સૂપર કોરિડોર ખાતે સ્થિત છીએ જ્યાં રોકાણોને પ્રોત્સાહિત કરીએ છીએ અને વૈશ્વિક સ્તરે અમારી સફળતામાં વૃદ્ધિ કરી રહ્યા છીએ. અમે બનાવી રહ્યા છીએ એવા ગતિશીલ શહેરી કેન્દ્રો જે તકોનો તણખો ચાંપે છે અને અહીં કામ કરતા લોકોમાં ગૌરવની લાગણીનો સંચાર કરે છે. અમે બ્રમ્પટનને આગળ ધપાવી રહ્યા છીએ જેથી તે એક જોડાણ ધરાવતું શહેર બને જે પ્રવર્તનાત્મક, વ્યાપક અને સાહસિક હોય. અમને [Twitter](https://twitter.com/brampton) અને [Facebook](https://www.facebook.com/brampton) પર ફોલો કરો. અહીં વધુ જાણકારી મેળવો [www.brampton.ca](http://www.brampton.ca).